

# IIT ગાંધીનગર ખાતે લીડરશીપ કોન્કલેવ યોજાશે

અમદાવાદ: IIT ગાંધીનગરમાં ૨૮, ૨૯ ડિસેમ્બરે યોજાનારી લીડરશીપ કોન્કલેવમાં વોશિંગ્ટન યુનિવર્સિટી, ક્લેમસન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વેસકોસન્સિન-મેડિસન, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કના પ્રોફેસરો ઉપસ્થિત રહેશે. પોર્ટુગલના ISCTE-લિસ્બન યુનિવર્સિટી, IIT દિલ્હી અને અન્ય અગ્રણી સંસ્થાઓના શિક્ષણવિદો તેમજ દેશ-વિદેશની અગ્રણી કંપનીઓના સીઈઓ હાજર રહેશે. કોન્કલેવમાં ફેકલ્ટી રિક્રૂટમેન્ટ, પ્રમોશનની પ્રક્રિયા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા બાબતે, સ્ટોક હોલ્ડરો સાથે સંકલન સાધવા અંગે અને શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય ભાગીદારી અંગે ચર્ચા હાથ ધરાશે.